


## દાહોદ જિલ્લો



- ❖ દાહોદ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની પૂર્વ તરફ આવેલો જિલ્લો છે.
- ❖ ગુજરાત રાજ્યની પૂર્વ સરહદ પર આવેલા પંચમહાલ જિલ્લામાંથી વિભાજન કરી જિલ્લાની રચના થઈ છે.
- ❖ દાહોદ જિલ્લાની ઉત્તરે મહીસાગર જિલ્લો અને રાજસ્થાન રાજ્ય, પૂર્વમાં મધ્યપ્રદેશ રાજ્ય, દક્ષિણમાં છોટાઉદેપુર જિલ્લો અને પશ્ચિમમાં પંચમહાલ જિલ્લાના સરહદો આવેલી છે.
- ❖ દાહોદ જિલ્લો ગુજરાતની સરહદ પર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ એમ બે રાજ્યોને અડીને આવેલો છે.
- ❖ દાહોદને ગુજરાતનો પૂર્વ દરવાજો કહેવામાં આવે છે.
- ❖ વિવિધ વિષય ની માહિતી અને રેગ્યુલર ફ્રી ટેસ્ટ, કરંટ અફેર્સ વગેરે માટે આજે જ ડાઉનલોડ કરો Gnan Bhandar મોબાઈલ એપ્લિકેશન
- ❖ ક્ષેત્રફળ :- ૩,૬૪૨ ચો. કિમી
- ❖ સ્થાપના :- ૦૨-૧૦-૧૯૮૭
- ❖ વિધાનસભાની કુલ સીટો :- ૭ (૧)ફતેહપુરા(એસ.ટી), (૨)ઝાલોદ (એસ.ટી), (૩)લીમખેડા(એસ.ટી), (૪)દાહોદ(એસ.ટી), (૫)ગરબાડા(એસ.ટી), (૬)દેવગઢબારિયા(એસ.ટી), (૭)સંતરામપુર (એસ.ટી) }
- ❖ તાલુકાઓ :- ૮ (૧)ગરબાડા, (૨)ઝાલોદ, (૩)દાહોદ, (૪)દેવગઢબારિયા, (૫)ધાનપુર, (૬)ફતેહપુરા, (૭)લીમખેડા, (૮)સંજેલી, (૯) ફતેહપુરા
- ❖ તાલુકા પંચાયતની કુલ સીટો :- ૮ (બેઠકો-૨૩૦) ( દાહોદ-૩૮, ગરબાડા-૨૪, ધનપુરા-૨૪, લીમખેડા-૨૪, ઝાલોદ-૩૮, દેવગઢબારિયા-૨૮, ફતેહપુરા-૨૮, સંજેલી-૧૬)

- ❖ જિલ્લા પંચાયતની કુલ સીટો :-૫૦
- ❖ નગરપાલિકાની સંખ્યા અને વોર્ડ :- ૧ ( દાહોદ-૯ (૩૬))
- ❖ વસ્તી :-૨૧,૨૬,૫૫૮ (૨૦૧૧ મુજબ)
- ❖ વસ્તી ગીચતા :- ૫૮૪
- ❖ સ્ત્રી પુરૂષ પ્રમાણ:- ૯૯૦( દર હજારે)
- ❖ અક્ષર જ્ઞાન :-૫૮.૬૨%
- ❖ મુખ્ય મથક :- દાહોદ
- ❖ આરટીઓ નં. :- GJ-20
- ❖ પોસ્ટ પીનકોડ નં. :-
- ❖ ગામડાંઓ :-૬૯૬
- ❖ ગ્રામ પંચાયત :- ૫૪૮
- ❖ ઉદ્યોગ:-ટર્બાઈન,હળવા વાહનો,ઓટોમોબાઈલ
- ❖ અભયારણ્ય :- રીંછ અભયારણ્ય (રતનમહાલ)
- ❖ નદીઓ:- પાનમ, હડક,માચનકાલી,દૂધમતી,કાળી,વાલવા
- ❖ જળ ધોધ :- પોયણીનો ધોધ (ઘોંઘબા તાલુકો),નાયગ્રા ધોધ(લીમખેડા તાલુકો),નલધા ધોધ,કઠિવાડા ધોધ
- ❖ વિવિધ વિષય ની માહિતી અને રેગ્યુલર ફ્રી ટેસ્ટ, કરંટ અફેર્સ વગેરે માટે આજે જ ડાઉનલોડ કરો Gnan Bhandar મોબાઈલ એપ્લીકેશન
- ❖ જળાશય :- કડાણા જળાશય યોજના
- ❖ તળાવ :- છાબ, રતનમાળ
- ❖ વાવ:- શનિની વાવ(હાથલા)
- ❖ પાક:- મકાઈ,મગફળી, ડાંગર,કપાસ,બાજરી,જવ,ચણા અને તમાકુ
- ❖ પર્વતો:- રતનમહાલ
- ❖ કિલ્લાઓ :- ગઢીનો કિલ્લો
- ❖ મેળાઓ :- ગોળ ગધેડાનો મેળો (જેસાવાડા), ગાય ગોહરીનો મેળો (નહેલાવ) અને આમલી અગિયારસનો મેળો, ચૂલનો મેળો
- ❖ રાષ્ટ્રીય રાજમાર્ગ :- નંબર – 59 (નવો નંબર- 47), નંબર – 113 (નવો નંબર- 56),
- ❖ રાષ્ટ્રીય રાજમાર્ગ :- રાષ્ટ્રીય રાજમાર્ગ- ૫૯ (નવો નંબર ૪૭) અને ૧૧૩ (નવો નંબર ૫૬)
- ❖ અગત્યના સ્થળો :- દેવગઢ બારીયા ,ઝાલોદ ,સંતરામપુર, રતનમહાલ (ધાનપુર), માનગઢહિલ (ગઢડા), ભમરેચીમાતાનું મંદિર , કંકનેશ્વરમહાદેવ

### વિશેષ નોંધ :

- ❖ દાહોદ વેપારી કેન્દ્રો છે. ગુજરાતનો પૂર્વ દરવાજા તરીકે દાહોદ ઓળખાય છે.
- ❖ દાહોદનું પ્રાચીન નામ દધિપૂરાનગર છે.
- ❖ દેવગઢબારીયા જુનું રજવાડી શહેર છે .અહીં મોટા ભાગે આદિવાસી વસ્તી વસે છે.
- ❖ આ જિલ્લામાં મુખ્યત્વે મકાઈ, ચણા, અડદ તેમ જ અન્ય શાકભાજીના પાક લેવામાં આવે છે.
- ❖ આ જિલ્લામાં દૂધમતી નદી, પાનમ નદી, માછણુ નદી, હડક નદી, કાળી નદી, પાન નદી લોકમાતાઓ છે.
- ❖ દાહોદ જિલ્લાનો લીમખેડા તાલુકો સૌથી પછાત તાલુકા તરીકે રાજ્યમાં બીજા ક્રમે આવે છે.
- ❖ સૌપ્રથમ સૂર્યોદય દાહોદના ગરબાડામાં થાય છે.
- ❖ મુઘલ બાદશાહ ઔરંગઝેબનો જન્મ સ્થળ દાહોદ છે.
- ❖ સૌથી ઓછી સાક્ષરતા દર ધરાવતો જિલ્લો છે., સૌથી ઓછી સ્ત્રી સાક્ષરતા ધરાવતો જિલ્લો છે.
- ❖ લીમખેડા કંજેટા મધ માટે જાણીતું છે.
- ❖ ગોળ ગધેડાનો મેળો દાહોદ જિલ્લાના જેસાવાડા ખાતે યોજાય છે.
- ❖ ગાય ગોહરીનો મેળો કારતક સુદ એકમે ગરબાળા ખાતે યોજાય છે.
- ❖ ગરબાડા તાલુકો દાહોદ જિલ્લાનો સૌથી નાનો તાલુકો છે.
- ❖ ગુજરાતમાં સૌથી વધુ મકાઈ પકવતો જિલ્લો દાહોદ છે.
- ❖ દાહોદ જિલ્લાનું બાવકામાં આવેલું શિવમંદિર ગુજરાતનું “ ખજુરાહો” તરીકે ઓળખવામાં આવે છે.

- ❖ ઘનપુર તાલુકામાં આવેલ રતનમહાલ રીંછ અભ્યારણ્યને ઈ.સ. 1982માં રતનમહાલ વન્ય પ્રાણી અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ અભ્યારણ્યમાં પાનમ નદીનું ઉદ્દગમસ્થાન આવેલું છે.
- ❖ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાનાં જેસાવાડા ગામમાં ધૂળેટીના દિવસે ગોળ ગધેડાનો મેળોનો મેળો ભરાય છે. આ મેળામાં ગોળ મેળવવા માટે ગધેડા જેટલો માર ખાય છે તેથી ગોળ ગધેડાનો મેળો કહેવામા આવે છે.
- ❖ વિવિધ વિષય ની માહિતી અને રેગ્યુલર ફ્રી ટેસ્ટ, કરંટ અફેર્સ વગેરે માટે આજે જ ડાઉનલોડ કરો Gnan Bhandar મોબાઈલ એપ્લિકેશન
- ❖ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નહેલાવ ગામમાં ભીલ જાતિના લોકોનો બેસતા વર્ષ અને ભાઈબીજના દિવસે આ મેળો ભરાય છે.
- ❖ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાગરડી અને ઝાલોદ તાલુકાનું રણીયાર ગામમાં ધૂળેટીના દિવસે આ મેળો યોજાય છે. આદિવાસીઓ લોકો પોતાના બાળકો અને પ્રાણીઓના(ઢોરઢાંખર) રક્ષણ માટે અગ્નિદેવતાની બાધા રાખે છે. આદિવાસી લોકો પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરતા ધગધગતા અંગારાઓઉપર ઉઘાડા પગે ચાલીને બહાર નીકળી જાય છે છતાં તેમના પગ થોડા પણ દાઝતા નથી. અને લોકો પોતાના બાળકો અને પ્રાણીઓના(ઢોરઢાંખર) રક્ષણ માટે અગ્નિદેવતાની બાધા રાખે છે.
- ❖ ઝાલોદ તાલુકાનું લીમડી ક્રાંતિવીર સરદારસિંહ રાણાનું જન્મસ્થળ છે.